

કોર્ટ ઓફ કમિશનર (વિકલાંગ વ્યક્તિઓ માટેના)

ગુજરાત રાજ્ય

(Deemed Civil Court) વિકલાંગ ધારો (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ૧૯૯૫

ભોંયતળિયે બ્લોક નં. ૧૬, જુના સચિવાલય, સેક્ટર-૧૦, ગાંધીનગર- ૩૮૨૦૧૦

કેસ નં. ૫૨૬/૨૦૧૫

ક્રમાંક કમિ/અપગ/૨૦૧૬-૧૭ /

તા. /૦૭/૨૦૧૬

અરજદાર:-

રણજીતસીંગ પ્યારાસાહેબ ગોહીલ,
ધી સોસાયટી ફોર ફીઝીકલી હેન્ડીકેપ્ડ અમદાવાદ,
૦૬, સુદામા હાઉસ, પ્રિતમનગર, એલીસબ્રીજ,
અમદાવાદ-૩૮૦ ૦૦૬.

વિરુદ્ધ

સામાવાળા:-

- (૧) શ્રી સચિવ, રાજ્ય રમતગમત પરિષદ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર.
- (૨) શ્રી કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર.
- (૩) શ્રી સીનીયર કોચ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર.
- (૪) શ્રી સંદિપ પ્રધાન, ડાયરેક્ટરશ્રી જનરલ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર.
- (૫) શ્રી તનસુખ છાંટબાર, સહાયક નિયામક, બ્લોક નં. ૧૪, ૩ જે માળ, જુના સચિવાલય, ગાંધીનગર

વિષય:- વિકલાંગ ધારો (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ૧૯૯૫ અન્વયે ફરિયાદ.

૧ અરજદારશ્રી ધી સોસાયટી ફોર ફીઝીકલી હેન્ડીકેપ્ડ અને રણજીતસીંગ પ્યારાસાહેબ ગોહીલ તથા અન્ય અરજદારો ધ્વારા તા.૩૧/૧૦/૨૦૧૫ થી આ કોર્ટમાં રજુઆત કરવામાં આવેલ કે, ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરીટી ધ્વારા રાષ્ટ્રીયકક્ષાએ અને આંતરરાષ્ટ્રીયકક્ષાએ વિજેતા ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર સામાન્ય રમતવીરોની જેમા આપવામાં આવતા નથી. પ્રસ્તુત અન્યાય દૂર કરી વિકલાંગ ધારો, ૧૯૯૫ અન્વયે વિકલાંગ રમતવીરોને સમાન ધોરણે લાભ મળે તેવા આદેશ કરવા ફરીયાદ

કરવામાં આવેલ. પ્રસ્તુત રજૂઆતને કેસ નં.૫૨૬/૨૦૧૫ તરીકે નોંધણી કરી કેસ રજીસ્ટરમાં કેસ દાખલ કરી પ્રતિવાદીઓને તા.૪/૧૧/૨૦૧૫ ની મુદતે હાજર રહેવા જણાવવામાં આવેલ.

૨. તા.૪/૧૧/૨૦૧૫ ની મુદતે વાદી ધી સોસાયટી ફોર ફીઝીકલ હેન્ડીકેપ્ડ, અમદાવાદ તરફથી સંસ્થાના પ્રમુખ શ્રી કાન્તીભાઈ પરમાર, શ્રી રણજીતસિંહ ગોહીલ તથા તમામ અરજદારો હાજર રહેલા. મુદતે તમામ અરજદારોએ લેખીત અને મૌખિક રજૂઆત કરતાં જણાવેલ કે, રાષ્ટ્રીયકક્ષા અને આંતર-રાષ્ટ્રીયકક્ષાએ વિજેતા થનાર ખેલાડીઓને ખેલ પ્રતિભા પૂરસ્કાર આપવા બાબતે દિવ્યાંગ ખેલાડીઓની માંગણી હોવા છતાં ડાયરેક્ટર જનરલ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ધ્વારા પ્રશ્નનો કોઈ નિકાલ ન કરતાં બાબત ૨૦૧૩-૧૪ થી આ બાબત પડતર રહેલ છે, જે ધ્યાને લઈ ડાયરેક્ટર જનરલ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ધ્વારા સામાન્ય ખેલાડીઓ માટેની યોજનાઓ સાથે એકસુત્રતા રાખી સામાન્ય ખેલાડીઓની જેમ દિવ્યાંગ ખેલાડીઓને સમાન ધોરણે પૂરસ્કાર અને પ્રોત્સાહન આપવા માટેની નીતિ નક્કી કરવામાં આવે. અરજદારો ધ્વારા ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ યુથ એફેર્સ એન્ડ સ્પોર્ટ્સ, ગર્વમેન્ટ ઓફ કર્ણાટક ઝારખંડ રાજ્ય, ઉત્તર પ્રદેશ રાજ્ય તથા અન્ય રાજ્યોની દિવ્યાંગ ખેલાડીઓ માટેની પ્રોત્સાહક નીતિઓ રજૂ કરી તે મુજબ ગુજરાત રાજ્ય માટે દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ નીતિ તૈયાર કરવામાં આવે તેવી રજૂઆત કરી.

૩. પ્રસ્તુત કેસની તા.૪/૧૧/૨૦૧૫, ૨૦/૧૧/૨૦૧૫, ૪/૧૨/૨૦૧૫, ૧૮/૧૨/૨૦૧૫, ૮/૨/૨૦૧૬, ૨૨/૨/૨૦૧૬, ૧/૩/૨૦૧૬, ૨૨/૩/૨૦૧૬, ૧૨/૭/૨૦૧૬ અને ૨૬/૭/૨૦૧૬ ના રોજ વખતોવખત મુદતો રાખવામાં આવેલ. મુદત સમયે ડાયરેક્ટર જનરલ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના પ્રતિનિધિ ધ્વારા લેખિતમાં રમતગમત મંડળને આપવામાં આવેલ તા.૫/૧૦/૨૦૧૫ નો પત્ર રજૂ કરી જણાવવામાં આવેલ કે, રમતગમતના ક્ષેત્રમાં વિકલાંગોને સામાન્ય રમતવીર ખેલાડીઓની માફક લાભો આપવા માટેની આવી કોઈ યોજના અમલમાં ન હોઈ લાભો આપી શકાય તેમ નથી. ત્યારબાદ તેઓ ધ્વારા રાજ્ય સરકારને વિકલાંગો માટે અલગથી નીતિ બનાવવા તા.૮/૧૨/૨૦૧૫ ના પત્રથી સરકારશ્રીમાં રજૂ કરવામાં આવેલ ભલામણની વિગતો રજૂ કરાયેલ.

૪. છેલ્લી મુદત દરમ્યાન સ્પોર્ટ્સ ઓથોરીટીના પ્રતિનિધિ ધ્વારા રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ધ્વારા તા.૨૮/૩/૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક: એસજીએ/૧૦૨૦૧૬/૧૬૧/બ થી ખેલાડી પ્રતિભા પુરસ્કાર યોજના જાહેર કરવામાં આવેલ તેની અંગ્રેજી અને ગુજરાતી પોલીસીની નકલ રજુ કરેલ છે. જેમાં રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય કક્ષા નિર્દીષ્ટ રમતગમત સ્પર્ધાઓમાં વિજેતા ગુજરાતના દિવ્યાંગ ખેલાડીઓને પુરસ્કૃત કરવાની યોજના તૈયાર કરવામાં આવેલ છે. જેની નકલ અરજદારોને પણ આપવામાં આવતાં અરજદારો ધ્વારા પ્રસ્તુત નીતિ વંચાણે લઇ હવે આ બાબતે તેઓને કોઇ પ્રશ્ન રહેતો ન હોઇ પ્રસ્તુત કેસ રદ કરવા અને કેસ દફતરે કરવા રજુઆત કરવામાં આવેલ છે, જે ધ્યાને લઇ હું નીચે મુજબ હુકમ કરું છું.

હુકમ

રાજ્ય સરકાર ધ્વારા તા. ૨૮/૩/૨૦૧૬ના ઠરાવથી દિવ્યાંગ ખેલાડીઓને પુરસ્કૃત કરવા માટે ખેલપ્રતિભા પુરસ્કાર યોજના પ્રસિધ્ધ કરવામાં આવેલ હોઇ અને પ્રસ્તુત કેસના અરજદારોના પશ્ચનો નિકાલ થયેલ હોઇ ધી સોસાયટી ફોર ફીઝીકલી હેન્ડીકેપ્ડ અમદાવાદ અને શ્રી રણજીતસીંગ પ્યારાસાહેબ ગોહીલ તથા અન્ય અરજદારો ધ્વારા કરવામાં આવેલ કેસ નંબર: ૫૨૬/૨૦૧૫ આથી દફતરે કરવા હુકમ કરું છું.

(સંજય નંદન)

કમિશનર

નકલ રવાના:-

- (૧) શ્રી રણજીતસીંગ પ્યારાસાહેબ ગોહીલ અને ધી સોસાયટી ફોર ફીઝીકલી હેન્ડીકેપ્ડ અમદાવાદ, ૦૬, સુદામા હાઉસ, પ્રિતમનગર, એલીસબ્રીજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬. તરફ જાણ સારૂ.
- (૨) શ્રી સચિવ, રાજ્ય રમતગમત પરિષદ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર.
- (૩) શ્રી કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર.
- (૪) શ્રી સીનીયર કોચ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર.
- (૫) શ્રી સંદિપ પ્રધાન, ડાયરેક્ટરશ્રી જનરલ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર.
- (૬) શ્રી તનસુખ છાંટબાર, સહાયક નિયામક, બ્લોક નં. ૧૪, ૩ જે માળ, જુના સચિવાલય, ગાંધીનગર

(७) सिलेक्ट झलल